

# શું તમે પહેલાની પેઢી કરતાં વધુ જીવવાનાં છો!!! શું તમે લાંબા ગાળાની નિવૃત્તિ માટે કોઈ યોજના બનાવી છે ?

## નિવૃત્તિનું આયોજન શા માટે ?

- કારણ કે તમારી સેકન્ડ છનિંગમાં તબીબી જરૂરિયાત વધુ ખર્ચાળ બનશે.
- કારણ કે તમે તમારાં બાળકોની નાણાકીય પરિસ્થિતિ પર બોજો બનવા નથી માગતાં.
- કારણ કે નિવૃત્તિને તમારે અથાગ પરિશ્રમના વળતર તરીકે મૂલવવી છે કોઈ સજા તરીકે નહીં.
- કારણ કે નિવૃત્તિને તમારી ભદ્રત્વકંશાઓ પરનાં પૂર્ણવિરામ તરીકે નહીં પરંતુ તમારી આશાની ઉડાન તરીકે મૂલવવી છે.
- કારણ કે આ કામકાજની નિવૃત્તિ છે, ધબકતા જીવનની નહીં.

## નિવૃત્તિનું આયોજન શું છે ?

- સરળ રીતે કહીએ તો નિવૃત્તિનું આયોજન એ વેતન મળતા કામનો અંત થાય તે પછીનાં જીવનની તૈયારી છે.
- યોગ્ય નિવૃત્તિનું આયોજન એટલે નિવૃત્તિ પછી તમારી અને તમારા પ્રિયજનોની જરૂરિયાત, માંગણીઓ અને ઇચ્છાઓ પૂરી કરી શકાય તે માટે જરૂરી નિવૃત્તિ ભંડોળ માટેનું સલામત, સુરક્ષિત અને સમયસર આયોજન.

A Public awareness initiative  
on old-age income security



પેંશન નિધિ વિનિયામક ઔર વિકાસ પ્રાધિકરણ  
Pension Fund Regulatory and Development Authority

આરામ દાયક નિવૃત્તિ વ્યવસ્થા માટે  
નાણાકીય આયોજન જરૂરી છે.

યાદ રાખો  
**નેશનલ પેન્શન સિસ્ટમ (એન્પીએસ)**



તમારાં નજીકના POP-SP જાણવા માટે ટોલફ્ઝી નંબર પર કોલ કરો

**1800 110 708**

OR

**SMS**

**NPS to 56677\***

\*પ્રમાણભૂત ખર્ચ લાગુ.

NPS વિષે વધુ જાણવા માટે અને POP-SP યાદી

જોવા માટે PFRDAની વેબસાઇટની

મુલાકાત લો

[www.pfrda.org.in](http://www.pfrda.org.in)

**NPS શું છે ?**

જે વધુ સક્ષમ, ટેકનોલોજી આધારિત પ્રણાલી છે જેમાં સેકન્ડ છનિંગ માટેની બચત માટે ભંડોળ એકહું કરવા અત્યારથી થોડી થોડી બચતની શરૂઆત કરવામાં આવે છે.

**NPS શા માટે ?**

- ઓછી ખર્ચાળ યોજના છે.
- વ્યક્તિગત, કર્મચારીઓ અને નોકરીદાતાઓ માટે કર રાહત
- આર્કષક બજારથી સંકળાયેલ વળતર
- સલામત, સુરક્ષિત અને સરળ રીતે સુવાધ
- પેન્શન ફંડના અનુભવી નિષ્ણાતો દ્વારા વ્યવસ્થાપન
- કાયદા દ્વારા સ્થાપિત નિયમન કર્ત્વી PFRDA દ્વારા નિયમન

**કોણ જોડાઈ શકે છે ?**

જો તમે નીચે દર્શાવેલ યોગ્યતા ધરાવો છો તો તમે જોડાઈ શકો છો:

- ભારતના નાગરિક - રહેવાસી કે બિન રહેવાસી
- જોડાતા સમયે ૧૮-૬૦ વર્ષની ઉંમર
- વેતન મેળવતા કે પોતાનો વ્યવસાય ધરાવતા હોવ

**હું NPS ખાતું ક્યાં ખોલાવી શકું ?**

PFRDA દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પેન્શન સુવિધા પૂરી કરનાર કેન્દ્ર (POP-SP)ની મુલાકાત લઇને.

